

G. P. Bvc. (Ec)—344—1,00,000—10—96.

FORM—2

ફોર્મ—૨

No. 81612

Certificate of registration under sub-section (1) of section 5 of the Gujarat State Tax  
On Professions, Trades, Callings and Employments Act, 1976.

ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને શેઠગાર વેરા અધિનિયમ, ૧૯૭૬ની કલમ પની પેટા-કલમો (૧)  
અને (૪) હેઠળ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર.

[ See rule 3 (2) ]

[ જુઓ નિયમ ૩ (૨) ]

No. ....

નંબર PR2205000048

This is to certify that the Proprietor/Partner/Principal Officer/Agent/Manager/Head  
of the Office/Establishment /Club/Association/Society/Corporation/Company known  
as..... and located at.....

.....has been registered as an employer under the  
Gujarat State Tax on Professions, Trades, Callings and Employments Act, 1976.

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે પોલ્યુકોન નિગમ ૨૨ જી.જી. ૪૪૪, જોલજીપુરા  
તરીકે જાણીતા અને ૨૧/૧૨/૭૬ સ્થળે આવેલા માલિક અથવા ભાગીદાર/મુખ્ય અધિકારી/એજન્ટ/  
મેનેજર/કચેરી સંસ્થા/ક્લબ/એસોસિએશન/મંડળી/કોર્પોરેશન/કંપનીના વડા, ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને શેઠગાર વેરા  
અધિનિયમ, ૧૯૭૬ હેઠળ કામે રાખનાર તરીકે રજિસ્ટર થયેલ છે.

The holder of this certificate has additional places of work at the following  
addresses :


આ પ્રમાણપત્ર ધરાવનાર પાસે નીચેના વધારાના કામના સ્થળો છે :-

Return in the prescribed form shall be furnished by the employer in respect of  
each month separately.

કામે રાખનારે દરેક મહિનાના સંબંધમાં ઠરાવેલા નમૂનામાં અલગ અલગ પત્રક પૂરું પાડવું જોઈશે.

The Tax shall be payable monthly with the return and receipted chalan in token  
of payment of tax shall be attached to the return.

વેરા દર મહિને પત્રક સાથે ભરવા યોગ્ય થશે અને વેરા ભરવા બદલનું રસીદવાળું ચલન, પત્રક સાથે જોડવું જોઈશે.



Seal :

Place :

સ્થળ : ૨૨

Date :

તારીખ : ૩૫/૧/૨૦૦૫

Signature :

સહી :

Designation : ડિપ્યુટી મેજિસ્ટ્રેટ/વેરાશલેસ કમિશનર

હોદ્દો :

થટક-૩,  
સુરત